

પરીપત્ર

આથી આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેના તમામ ઉપાડ અને ચુકવણા અધિકારીઓને જણાવવાનું કે, ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના આવકવેરાના સ્ટેટમેન્ટ આપના ઓફીસીયલ ઇ-મેલ એકાઉન્ટ ઉપર મોકલી આપવામાં આવેલ છે, તેમાંથી આપશ્રીની કચેરીમાં ફરજ બજાવતાં અધિકારીઓ તથા કર્મચારીઓના આવકના સ્ટેટમેન્ટ કાઢીને આપશ્રીની કચેરી ખાતેથી પહોંચતા કરવાના રહેશે. સદરહું આવકવેરાના ફોર્મ ભરીને જરૂરી આધારપુરાવા સાથે સામેલ રાખી આપશ્રીની કક્ષાએથી જરૂરી ચકાસણી કરી હિસાબ નિયામકશ્રીના તા.૦૧/૦૧/૨૦૧૯ના પરિપત્રમાં જણાવેલ સુચનાનુસર અમલવારી કરીને તા.૨૦/૦૧/૨૦૧૯ સુધીમાં અત્રેની કચેરીના પે એન્ડ પેન્શન સેલને બે (૨) નકલમાં મોકલી આપવાના રહેશે.

વધુમાં ચાલુ નાણાંકીય વર્ષ-૨૦૧૮-૧૯ દરમિયાન આવકવેરા કપાત અંગેની નીચેની કેટલીક બાબતો ધ્યાને રાખવાની રહેશે.

- (૧) ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન આવકવેરાની સેક્શન-૧૬ (ia) મુજબ રૂ.૪૦,૦૦૦/- કપાતનો પગારદારોને લાભની સામે તેઓને મળવાપાત્ર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (વાર્ષિક રૂ.૧૯,૨૦૦/-) તેમજ મેડીકલ રી-એમ્બર્સમેન્ટ (વાર્ષિક રૂ.૧૫,૦૦૦/-) ની પ્રવર્તમાન કરમુકિતની જોગવાઈ નાબુદ કરવામાં આવેલ છે જેની નોંધ લેવી.
- (૨) આપની કચેરીમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓના આવકમાં માહેજાન્યુઆરી-૨૦૧૯માં જો કોઈ ઇજાફો આવતો હોય તો તેની માહિતી રૂબરૂમાં આવીને અપડેટ કરાવી જવાની રહેશે અન્યથા તે અંગેની સઘળી જવાબદારી જે તે ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીની રહેશે.
- (૩) આપની કચેરીમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓના આવકવેરાના સ્ટેટમેન્ટમાં જો કોઈ એરીયર્સની રકમ રહી ડિસેમ્બર-૨૦૧૮ સુધીની રહી ગઈ હોય અથવા જાન્યુઆરી-૨૦૧૯ બાદ ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કોઈ એરીયર્સનું ચુકવણું કરવાનું હોય તો તેની વિગત રૂબરૂમાં આવીને અપડેટ કરાવી જવાની રહેશે અન્યથા તે અંગેની સઘળી જવાબદારી જે તે ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીની રહેશે.
- (૪) સમયમર્યાદામાં ન આવેલ અધિકારી/ કર્મચારીઓના ઇન્કમેટેક્સના ફોર્મ અંગેની જવાબદારી જે તે ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીની રહેશે.
- (૫) જાન્યુઆરી-૨૦૧૯ થી માર્ચ-૨૦૧૯ સુધીમાં આપની કચેરીએથી જે કોઈ માનદવેતનના મહેતાણાંનું ચુકવણું કરવાનું થાય ત્યારે તેની સઘળી માહિતી તા.૨૦/૦૧/૨૦૧૯ સુધીમાં એમ્પ્લોયમેન્ટ નંબર સાથે અત્રેની કચેરીના પે-સેલના ઇ-મેલ ઉપર મોકલી આપવાની રહેશે. અન્યથા જે તે ઉપાડ અને ચુકવણા અધિકારી તથા જે મહેનતાણુ મેળવનાર કર્મચારીએ પોતાને મળેલ મહેનતાણાનો ટેક્સ તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીમાં ભરી અને તેનું ચલણની કોપી અત્રેની કચેરીને મોકલેલ હશે તો જ ફોર્મ-૧૬ માં તેનો ઉલ્લેખ કરવામાં આવશે.

નં.હિ.નિ./પે.સેલ/ ૭૦૬૩

/૨૦૧૮

21/1/2019  
હિસાબી અધિકારી  
(પી.એફ./પેન્શન)

નકલ રવાના : આણંદ ઝોનના તમામ યુનિટ અને સબ યુનિટ તથા ઉપાડ અને ચુકવણા અધિકારીકારીશ્રીઓ તરફ જાણ તથા જરૂરી કાર્યવાહી કરવા સારું.



|    |                                                                                                                                           |        |                |                |                             |  |
|----|-------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------|----------------|----------------|-----------------------------|--|
| 20 | INCOME TAX PAYABLE ON TAXABLE INCOME (18-19)                                                                                              |        |                |                | ₹                           |  |
| 21 | TAX PAYABLE                                                                                                                               |        |                |                | ₹                           |  |
|    | LESS :-TOTAL TAXABLE INCOME NOT EXCEEDING RS.3,50,000, THE AMOUNT OF REBATE IS RS.2500/- OR THE AMOUNT OF TAX PAYABLE WHICH EVER IS LOWER |        |                |                | ₹                           |  |
|    | NET TAX PAYABLE                                                                                                                           |        |                |                | ₹                           |  |
|    | +4% (HEALTH + EDU.CESS)                                                                                                                   |        |                |                | ₹                           |  |
|    | NET TAX PAYABLE                                                                                                                           |        |                |                | ₹                           |  |
| 22 | TAX PAID UPTO <b>December-2018</b>                                                                                                        |        |                |                | ₹                           |  |
| 23 | NET TAX PAYABLE (21-22)                                                                                                                   |        |                |                | ₹                           |  |
| 24 | Jan/19                                                                                                                                    | Feb/19 | BY SELF CHALAN | BY SELF CHALAN | TOTAL<br>JAN + FEB + CHALAN |  |
|    | ₹.                                                                                                                                        | ₹.     | ₹.             | ₹.             | ₹.                          |  |

**CERTIFICATE**

Certified that the information regarding total income and deduction mentioned in the statement is correct as Per Income-tax Act. ઉપરોક્ત માહિતી અને ટેક્સની ગણતરી સાધનિક પુરાવા આધારીત કરવામાં આવેલ છે જે મારી જાણ મુજબ બરાબર છે અને ભવિષ્યમાં આ બાબતે આવકવેરા વિભાગમાંથી જો કોઈ નોટીસ આવશે અને જો નાણા/ પેનલ્ટી ભરવાની થશે તો તે ભરવાની હું બાંહેધરી આપું છું

Date:        /        /2019

SIGNATURE:-

**RATE OF INCOME-TAX F.Y 2018-2019**

**A.Y. 2019-2020**

| INDIVIDUAL |                          |                                                                | SR.CITIZEN (60 - 80 years) |                                                                | SUPER SR.CITIZEN (80 & Above) |                                                                |
|------------|--------------------------|----------------------------------------------------------------|----------------------------|----------------------------------------------------------------|-------------------------------|----------------------------------------------------------------|
| 1          | UP TO RS. 2,50,000       | RS.NIL                                                         | UPTO RS.3,00,000           | RS.NIL                                                         | UPTO RS.5,00,000              | RS.NIL                                                         |
| 2          | RS.2,50,001 TO 5,00,000  | 5% OF (TOTAL INCOME MINUS RS. 2,50,000) 87A- REBATE RS.2,500   | RS.3,00,001 TO 5,00,000    | 5% OF (TOTAL INCOME MINUS RS. 3,00,000) 87A- REBATE RS.2,500   | -                             | -                                                              |
| 3          | RS.5,00,001 TO 10,00,000 | Rs.12,500/- + 20% by which total income exceeds Rs.5,00,000    | RS.5,00,001 TO 10,00,000   | Rs.10,000/- + 20% by which total income exceeds Rs.5,00,000    | RS.5,00,001 TO 10,00,000      | 20% by which total income exceeds Rs.5,00,000                  |
| 4          | Above Rs.10,00,000       | Rs.1,12,500/- + 30% by which total income exceeds Rs.10,00,000 | Above Rs.10,00,000         | Rs.1,10,000/- + 30% by which total income exceeds Rs.10,00,000 | Above Rs.10,00,000            | Rs.1,00,000/- + 30% by which total income exceeds Rs.10,00,000 |

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (છ વર્ષિય રાષ્ટ્રિય બચતપત્રો)નું લેણું થયેલ વ્યાજની ગણતરીનો કોઠો હાલમાં આઠમી શ્રેણીના રાષ્ટ્રિય બચતપત્રો ઈસ્યુ થાય છે, જે છ વર્ષ (વ્યાજ સહિત) પરત ચૂકવાય છે. દર વર્ષ લેણા થયેલ વ્યાજની સરળ ગણતરી નીચે પ્રમાણે કરી શકાય દર રૂ.1૦૦ ઉપર લેણું થયેલ વ્યાજ (Accrued Interest)@

| YEAR   | NSC PURCHASED 1-1-99 TO 14-1-00 | NSC PURCHASED 15-1-00 TO 28-2-01 | NSC PURCHASED 1-3-01 TO 28-2-02 | NSC PURCHASED 1-3-02 TO 28-2-03 | NSC PURCHASED AFTER 1-3-03 |
|--------|---------------------------------|----------------------------------|---------------------------------|---------------------------------|----------------------------|
| FIRST  | 11.83                           | 11.3                             | 9.72                            | 9.2                             | 8.16                       |
| SECOND | 13.23                           | 12.58                            | 10.67                           | 10.05                           | 8.83                       |
| THIRD  | 14.8                            | 14.00                            | 11.71                           | 10.97                           | 9.55                       |
| FOURTH | 16.54                           | 14.58                            | 12.85                           | 11.98                           | 10.33                      |
| FIFTH  | 18.51                           | 17.35                            | 14.1                            | 13.09                           | 11.17                      |
| SIXTH  | 20.69                           | 19.31                            | 15.47                           | 14.29                           | 12.08                      |

નોંધ :-૧) P.P.F ઉપર વાર્ષિક વ્યાજ તા.૧.૩.૨૦૦૩ થી ૮% અને બચતપત્રો ઉપર પણ ૮% નો વ્યાજનો દર છે. આથી રૂ.૧૦૦/- ના NSC ના પાકતી મુદતે રૂ.૧૬૦.૧૦ પરત મળશે.

| REGARDING ON HBA INTEREST |           |                                                                                          |
|---------------------------|-----------|------------------------------------------------------------------------------------------|
| 30000                     |           | Either the actual amount accrued or Rs.30000 whichever is less.                          |
| 75000                     | 2000-2001 | When the borrower is on or after 1-4-99 and construction or acquisition is before 1-4-01 |
| 100000                    | 2001-2002 | When the borrower is on or after 1-4-99 and construction or acquisition is before 1-4-03 |
| 150000                    | 2002-2003 | When the borrower or acquisition is after 1-4-2003                                       |

| PROFORMA |                    |                                   |                                                            |                                             |         |
|----------|--------------------|-----------------------------------|------------------------------------------------------------|---------------------------------------------|---------|
| SR NO    | NAME OF INVESTMENT | AMT.INVESTMENT DEPO.PREM.PAID ETC | DATE OF DEPOSIT THE AMT OR DT. OF ISSUE CERTI OR PREM PAID | LIC POLICY NSS/ CTD/PPF A/C NO NSC CERI NOS | REMARKS |
|          |                    |                                   |                                                            |                                             |         |
|          |                    |                                   |                                                            |                                             |         |
|          |                    |                                   |                                                            |                                             |         |

CHECKED BY

DDO

AUDIT OFFICER  
PAY & PENSION CELL